

GS, MS અને C.S. પાર્થપો  
ગેલ્વનાઈઝ્ડ તેમજ MS ચોરસ  
અને લંબચોરસ પાર્થપો  
IBR પાર્થપો અને IBR ફીટીંગ્સ  
MS અને GI ફીટીંગ્સ અને વાલ્વ  
ચેનલ એન્ગલ, બીમ, પ્લેટ

**MUGATLAL B. & SONS**  
"મુગટ હાઉસ"  
ઉદ્યોગ મેઈનરોડ, કિષ્કા પેટ્રોલ પંપની બાજુની ગલીમાં સુરત.  
● બ્રાન્ચ : પ્લોટ નં.-૬૦૫, રોડ નં.-૬, G.I.D.C., સચીન.  
ફોન : ૨૩૬૮૬૧૧, ૨૩૪૨૪૭૦ (મો.) ૯૮૨૪૧૦૬૩૩૩ સચીન  
● E-mail : info@mugatlalsons.com ●

# ગુજરાતમિત્ર

તથા ગુજરાતદર્પણ સ્થાપના:૧૯૭૩

સંવર્ધક તંત્રી : સ્વ. પ્રવીણકાન્ત ઉત્તમરામ રેશમવાળા  
તંત્રી : મુદ્રક : પ્રકાશક : ભરત પ્રવીણકાન્ત રેશમવાળા

શેઠ પી. ટી. સુરત જનરલ હોસ્પિટલ  
ડૉ. ભટ્ટની હોસ્પિટલ  
બાલાજી રોડ, સ્વ. શ્રી કનૈયાલાલ મોદી માર્ગ, સુરત.  
ફોન : ૦૨૬૧-૨૫૯૨૦૪૦, ૨૫૯૨૦૪૧, ૨૬૦૪૦૦૦

સરકારશ્રીની "માં કાર્ડ યોજના"  
હેઠળ અનુભવી ડૉક્ટર્સ દ્વારા  
જનરલ સર્જરી અને ENT સર્જરી  
ફ્રી કરવામાં આવે છે.

કેશવેસ અને મોડીકલેઈમની સેવા ઉપલબ્ધ - ૨૪ કલાક ઈમરજન્સી  
સાચા અર્થમાં ટ્રસ્ટ હોસ્પિટલ...

માલિક: ગુજરાતમિત્ર પ્રા.લિ. પ્રકાશન સ્થાન: ગુજરાત સ્ટાન્ડર્ડ પ્રેસ, ગુજરાતમિત્ર ભવન, સોની ફળિયા, સુરત-૩૯૫૦૦૩ | e-mail:mitra@gujaratmitra.in | ટે.નં.: જા.ખ. વિભાગ: ૨૫૯૯૯૯૯, ફેકસ: ૨૫૯૯૯૯૦, વ્યવસ્થા, તંત્રી વિભાગ: ૨૫૯૯૯૯૨/૩/૪  
GUJARATMITRA AND GUJARATDARPAN  
Regd.No. SRT-006/2024-26 \* RNI No.1597/57 વર્ષ: ૧૬૩ \* \* \* સંવત ૨૦૮૨ વૈશાખ અમાસ શનિવાર ૧૬ મે, ૨૦૨૬ \* \* \* દૈનિક : ૮૯ - અંક : ૧૭૩ પાનાં ૧૨+૧૨ કિંમત ₹ ૫.૦૦



Atmanirbhar Bharat  
Viksit Bharat

સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ

## "રાષ્ટ્ર પ્રથમ"



શ્રી પ્રફુલ પટેલ

માનનીય પ્રદાસક  
દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ સંઘ પ્રદેશ અને લઘુદ્વીપ

"ચાલો દેશભક્તિની ભાવનાને જાગૃત કરીએ અને એવું વાતાવરણ નિર્માણ કરીએ કે જેથી દેશ વૈશ્વિક સંકટોમાંથી લાલ મેળવી શકે અને પરિસ્થિતિનો સફળતાપૂર્વક સામનો કરી શકે. ત્યારે જ દેશ સફળ બનશે."

શ્રી નરેન્દ્ર મોદી



શ્રી નરેન્દ્ર મોદી

માનનીય પ્રધાનમંત્રી, ભારત



### જાહેર અપીલ



PNG ને પ્રાથમિક ઊર્જા સ્ત્રોત તરીકે અપનાવો



અઠવાડિયામાં એક દિવસ ઇંધણ ખરીદવાનું ટાળો



ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ આગળ વધો



પર્યટકો સમુદ્ર કિનારા માર્ગ પર સાયકલનો ઉપયોગ કરો / પોતાની સાયકલ સાથે લાવો



ખાદ્ય તેલનો ઉપયોગ ઘટાડો



માસિક ઇંધણ વપરાશ ઘટાડો



કાર પૂર્લિંગનો ઉપયોગ કરો



શક્ય હોય ત્યાંથી ઘરેથી કામ કરો



જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરો